

Gujarati

You are entitled to help from an independent mental health advocate if you want it. These advocates are independent of people involved in your care.

જો તમારે જોઈએ તો, તમે સ્વતંત્ર માનસિક આરોગ્ય વકિલ પાસેથી મદદ લેવા માટે હકદાર છો. આ વકિલો તમારી સંભાળમાં સામેલ લોકોથી સ્વતંત્ર છે.

They can help you get information about your care and treatment, why you are being kept in hospital, what it means and what your rights are. They can come to see you and help you understand what you are told by people involved in your care and treatment. If you want, they can help you talk to these people or they can talk to them for you. They can also help you with the Tribunal.

તેઓ તમને તમારી સંભાળ અને સારવાર, તમે કેમ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, તેનો શું અર્થ છે અને તમારા હકો કયા છે તે અંગે માહિતી આપવા માટે મદદ કરી શકે છે. તેઓ તમને જોવા આવી શકે છે અને તમારી સંભાળ અને સારવારમાં સામેલ લોકો દ્વારા તમને શું કહેવામાં આવી રહ્યું છે તે તમને સમજવામાં મદદ કરી શકે છે. જો તમે ઇચ્છો તો તેઓ તમને આ લોકો સાથે વાત કરવામાં તમને મદદ કરી શકે છે અથવા તેઓ તમારા વતી તેઓની સાથે વાત કરી શકે છે. તેઓ તમને ટ્રિબ્યુનલ સાથે પણ મદદ કરી શકે છે.

You can contact the independent mental health advocacy service yourself.

તમે પોતાની જાતે સ્વતંત્ર માનસિક આરોગ્ય વકિલાત સેવાનો સંપર્ક કરી શકો છો.